

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટનમાં કેનેડા ડેનો ઉત્સવ ઉજવો!

બ્રમ્પટન, ઓન્ટારિયો (17 જૂન 2022) – સિટી ઓફ બ્રમ્પટનને જણાવતા આનંદ થાય છે કે ચિંગકુઝી પાર્કમાં જુલાઈ 1ના રોજથી બપોરે 12 થી સાંજે 10 વાગ્યા સુધી કેનેડા ડેની ઉજવણી રૂબરૂ સ્વરૂપમાં પાછી ફરી રહી છે. બ્રમ્પટનની કેનેડા ડેની ઉજવણી સિટીમાં થતી એક માત્ર એવી એક દિવસીય ઉજવણી છે જે સૌથી ભવ્ય રહી છે જ્યારે આ પ્રસંગને લાઈવ મનોરંજન, કલા, સંસ્કૃતિ, ફૂડ અને આતશબાજી અને બીજી ઘણી બધી બાબતોથી ઉજવણી કરવામાં આવે છે!

પરિવાર સાથે મૈત્રીપૂર્ણ (ફિમિલી ફ્રેન્ડલી) મનોરંજન

ગમ્મતનો ગુલાલ ઉછાળવા માટે સમગ્ર પરિવારને તે દિવસે સાથે લાવશો:

- ઈન્ફલેટેબલ ઝોનમાં ઉછળકુદ કરો અને ગમ્મત કરો;
- ચિંગકુઝી પાર્કમાં હોય તેવી બધી જ સવલતોને માણો જેમાં સામેલ છે સ્પ્લેશ પેડ અને રમતના મેદાનો, સ્કેટબોર્ડ પાર્ક, મિનિ ગોલ્ફ, કૂઝલ અને પાટા વિનાની ટ્રેઈન, ભાડે મળતી પેડલ બોટ, મિનિ મૂ ફાર્મ અને બીજું ઘણું;
- ફૂડ અને છૂટક વિક્રેતાઓના ઝોનમાં સ્થાનિક વ્યવસાયોને સમર્થન આપો;
- કાઉન્સિલના સભ્યો સાથે કપકેક ની લડાણી;
- મેરિડિયન ક્રેડિટ યુનિયન દ્વારા રજૂ થનાર વોટર-રિફ્રીલ સ્ટેશનો;
- ટિમ હોર્ટન દ્વારા રજૂ થનાર લાઈવ આતશબાજી રાત્રે 10 વગ્યે; અને
- બીજું ઘણું બધું!

લાઈવ મનોરંજન

ચિંગકુઝી સિંગ ઓરકેસ્ટ્રા, બ્રમ્પટન ફોક ક્લબ અને એક્લેક્ટિક રિવાઈવલ આખી બપોર મુલાકાતીઓને પેડલ બોટ પેવિલિયન પાસે સંગીતથી મનોરંજન પૂરું પાડશે. પછી તમે સાંજે 6 વાગ્યે જઈ શકશો લાઈવ મ્યુઝિકના કાર્યક્રમ માટે કન્સર્ટ ઝોન પર જેસી જોન્સને સાંભળવા જેઓ મિડિયાની પ્રખ્યાત હસ્તી છે, ઉદ્યોગસાહસિક અને સાંસ્કૃતિક દૂત છે. રાષ્ટ્ર ગીતનું ગાન કરવાના કાર્યક્રમને રજૂ કરશે રોબર્ટો બટાગ્લિયા જેના બાદ બ્રમ્પટન રેપર સિપ્ટી પોતાનો કાર્યક્રમ રજૂ કરશે જેના પછી આવશે જૂનો નામાંકિત સ્નોટી નોઝ રેઝ ક્રિડ્સ અને પ્રખ્યાત એવા અને હિપ હોપ લિજન્ડ કાર્ડિનલ ઓફ્શોલ, આ બધી વસ્તુઓથી તમે માણશો એક એવી સાંજ જે તમે ક્યારેય ભૂલી નહીં શકશો. સાંજને અંતે રાત્રે 10 વાગ્યે ટિમ હોર્ટન દ્વારા એક અદ્ભૂત આતશબાજીનો કાર્યક્રમ રજૂ કરાશે જેનાથી કેનેડાના જન્મદિનનો મહોત્સવ મનાવાશે.

સ્પિટી બ્રમ્પટનવાસી એક ભારતીય-કેનેડિયન રૅપર છે જેઓ આખા વિશ્વમાં સમર્પિત અને વિકસતા ચાલકવર્ગ ઊભો કરીને પોતાનો ડંકો વગાડી રહ્યા છે. 2021માં સ્પિટીએ તેમનું ડેબ્યુ આલ્બમ ફૂલ સર્કલ બહાર પાડ્યું હતું જે માટે કેટલાયે પ્રકાશનોએ તેમના વખાણ કર્યા હતા જેમાં સામેલ છે રોલિંગ સ્ટોન ઈન્ડિયા અને મછ મ્યુઝિક, જે તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પહોંચને દર્શાવે છે. આલ્બમના જોરે, સ્પિટીએ તેમના ટોરોન્ટો કન્સર્ટમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સમગ્ર દક્ષિણ ઓન્ટારિયોને કાર્યક્રમો કરીને ગજવ્યું હતું જેના પછી તેઓએ પોતાનું સંગીત 2022ના પૂર્વાર્ધમાં યુએસએની 6 સપ્તાહની ટૂર કરીને પીરસ્યું હતું. ત્યારથી જ તેઓએ પોતાની ગતિ જાળવી રાખી છે અને તેમણે હાલમાં જ ડુન્ડાસ સ્ક્વેર ખાતે દેસી ફેસ્ટમાં, કેનેડિયન મ્યુઝિક વીકમાં, NXNE અને ડાઉનટાઉન બ્રમ્પટનમાં BVX ફેસ્ટમાં કાર્યક્રમો કર્યા છે.

હવે, સ્પિટીનું લક્ષ્ય નવું હિટ બને તેવું સંગીત પીરસવાનું છે અને આવા ઊર્જાથી છલકાતા લાઈવ શો કરતા રહેવાનો પ્રવાસ જારી રાખવો છે.

સ્નોટી નોઝ રેઝ ક્રિડ્સ તે ફર્સ્ટ નેશનસની હિપ હોપ જોડી છે જેમાં છે હાઈસલા રૅપર્સ ડેરેન "યંગ ડી" મેલ્ડ અને કિવન્ટન "યૂંગ ત્રીબેઝ" નાઈસ. તેઓ મૂળ કિટામાટ વિલેજ, બ્રિટિશ કોલમ્બિયાના છે અને હાલમાં વેન્કુવરમાં સ્થાયી છે. તેમનું 2017 આલ્બમ દ અવરેજ સેવેજ 2018 પોલારિસ મ્યુઝિક પ્રાઈઝ માટે નામાંકિત થયું હતું અને તેઓ 2019 અને 2022ના જુનો એવોર્ડ્સમાં જુનો એવોર્ડ ઈન્ડિજનસ મ્યુઝિક આલ્બમ ઓફ ટ યર માટે નામાંકિત થયા હતા.

કાર્ડિનાલ ઓફિશલ એક રૅપર છે, રેકોર્ડના નિર્માતા છે, DJ છે અને રેકોર્ડ એગ્જિક્યુટિવ છે. જેમનું વર્ણન ઘણી વખત કેનેડાના "હિપ હોપ એમ્બેસેડર" તરીકે કરવામાં આવે છે અને તેમને દેશના સર્વશ્રેષ્ઠ હિપ-હોપ ક્લાકાર પૈકી એક માનવામાં આવે છે અને તેઓ તેમના વિશિષ્ટ રેગ (reggae) અને ડાન્સહોલ પ્રભાવિત હિપ-હોપની શૈલી માટે જાણીતા છે.

સિટી ઓફ બ્રમ્પટનના કેનેડા ડેનું ઉદાર હાથે થયેલ પ્રાયોજન મેરિડિયન કેડિટ યુનિયન, ટિમ હોર્ટન્સ, અલેક્સ્ટ્રા, બેલ, કોક કેનેડા બોટલિંગ, ક્વોલિટી સ્વીટ્સ, નો ફિલ્સ અને સિમ્પ્લી ફાઈનેન્શ્યલ દ્વારા થયું છે.

ચિંગુકુઝી પાર્ક (Chinguacousy Park) 9050 બ્રેમલિ રોડ ખાતે સ્થિત છે. ઓન-સાઈટ પાર્કિંગ વાહન દીઠ \$20 સુધી મર્યાદિત છે અને હંગામી ધોરણે રોડ ક્લોઝર્સ મુકવામાં આવશે. સહભાગીઓને ચાલવા, પોતાની બાઈકની સવારી કરવા, અથવા તે દિવસે બ્રમ્પટન ટ્રાન્ઝિટ દ્વારા આપવામાં આવનાર મફત શટલ સેવાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મધ્યાહનથી શરૂ થશે અને દર 30 મિનિટે નીચે આપેલ સ્થળોથી મફત શટલ સેવા મેળવી શકાશે:

- માઉન્ટ પ્લેઝન્ટ GO સ્ટેશન
- ટ્રિનિટી કોમન મોલ
- શેરિડાન કોલેજ
- ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર અને ગ્રંથાલય (Gore Meadows Community Centre and Library)

ચિંગકુઝી પાર્ક પાસે નીચે આપેલ વૈકલ્પિક પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ રહેશે:

- બ્રેમલિ સિટી સેન્ટર
- બ્રેમ્પટન સિવિક સેન્ટર
- ગ્રીનબ્રિઅ રિક્લિએશન સેન્ટર
- લેસ્ટર બી પિઅરસન કેથોલિક સ્કૂલ
- સેન્ટ ઝો દ બ્રેબોફ (St. Jean Brebeuf) કેથોલિક સ્કૂલ
- ટેરી મિલર રિક્લિએશન સેન્ટર

કેનેડા દિનના ઈવેન્ટ વિશેની વધુ માહિતી માટે મુલકાત લો brampton.ca/canadaday.

સુવાક્યો

"અમને ખરેખર આ વખતે રહેવાસીઓની વ્યક્તિગત રીતે અમારા સૌથી મોટા વાર્ષિક પ્રસંગે કેનેડા ડેના મહોત્સવમાં મહેમાનગતી કરતા આનંદ થાય છે! જુલાઈ 1ના રોજ ચિંગકુઝી પાર્ક ખાતે અદ્ભૂત લાઈવ મનોરંજન, કલા, સંસ્કૃતિ, ફૂડ અને આતશબાજી માટે અમારી સાથે જોડાઓ. પરિવારના પ્રત્યેક સભ્ય માટે અહીં કંઈકને કંઈક માણવા જેવું મળી રહેશે!

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ચિંગકુઝી પાર્ક ખાતે કેનેડા ડે માટે અમારી સાથે જોડાવા રહેવાસીઓ અને મુલાકાતીઓને અમારું આમંત્રણ છે! જૂનો નામાંકિત સ્નોટી નોઝ રેઝ કિડ્સ અને પ્રખ્યાત એવા અને હિપ હોપ લિજન્ડ કાર્ડિનલ ઓફિશિયલના કાર્યક્રમો, આતશબાજી દર્શન અને પરિવાર માટે મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે ઉજવીશું કેનેડાનો જન્મ દિન. ઓન-સાઈટ પાર્કિંગ મર્યાદિત હોવાથી ચાલતા, કે બાઈક પર અથવા અમારી મફત બ્રેમ્પટન ટ્રાન્ઝિટ શટલ સેવાઓનો લાભ લેવાનું વિચારશો.

- હરકિરત સિંઘ ઉપ-પ્રમુખ, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

ફરી એક વાર રૂબરૂ સ્વરૂપમાં કેનેડા ડેની ઉજવણીમાં આ વર્ષે રહેવાસીઓને આવકારવા અમે સહુ ઉત્સુક છીએ. પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની એક અતિઅદ્ભૂત લાઈનઅપ ચિંગકુઝી પાર્ક ખાતે જુલાઈ 1ના રોજ યોજાશે તેમાં સિટી સાથે જરૂરથી જોડાશો."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન



Media Release

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca